

## **FEE REFUND PROCESS (TO BE FOLLOWED BY STUDENTS)**

**(એડમિશન કેન્સલ કરાવવા તથા ફી પરત મેળવવા કરવાની થતી પ્રક્રિયા)**

- એડમિશન કેન્સલ કરાવવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે મુજબની સુચનાઓ અનુસરવાની રહેશે.

### **Case No.-1 (કોલેજ ખાતે હાજર થઈ અને એડમિશન કન્ફર્મ કરાવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે જ)**

- જે વિદ્યાર્થીએ ટોકન ફી ભરી રૂબરૂ કોલેજ ખાતે હાજર થઈ અને એડમિશન કન્ફર્મ કરાવેલ હોય અને તેવા વિદ્યાર્થીઓ ને એડમિશન કેન્સલ કરાવવું હોય તો તે માટે ફરજિયાત તેઓએ પ્રવેશ મેળવેલ કોલેજ ખાતેથી જ રૂબરૂ એડમિશન કેન્સલ કરાવવાનું જવાનું રહેશે તથા ટોકન ફી ના રીફંડ માટે વિદ્યાર્થીએ તે કોલેજ ખાતે નિયત નમુનામાં રીફંડની અરજ પ્રીન્સીપાલને ભરેલ ટોકન ફી ના ચલણની નકલ સાથે આપવાની રહેશે.
- ઉપરોક્ત અરજ ફોર્મ ભરીને જે તે કોલેજમાં સબમીટ કર્યા બાદ તે કોલેજ ખાતેથી તમારૂં એડમિશન કેન્સલ કરવામાં આવશે.
- ત્યારબાદ તે વિદ્યાર્થીના રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇડી પર ટોકન ફીના રીફંડ માટેની લીંક મોકલવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ એ **રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇડી પર** મળેલ લીંક પર જરૂરી માહિતી ભરી સબમીટ કરી તેની એક પ્રીન્ટ કાઢી, તેમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટનો એક સેટ બનાવવાનો રહેશે. જે હાર્ડકોપીમાં **કુલસચિવશ્રી ની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ-૩૬૨૦૦૧** ના સરનામે રજી.એડી./રૂબરૂ અરજ પહોંચાડવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયે જે તે વિદ્યાર્થીની ટોકન ફી પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વધુમાં જે વિદ્યાર્થીઓની હાર્ડકોપી સમયમર્યાદામાં અત્રેની કચેરીને નહીં પહોંચે તે વિદ્યાર્થીની ટોકન ફી નિયમોનુસાર રીફંડ થઈ શકશે નહીં જેની વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ખાસ નોંધ લેવી.

### **Case No.-2 (ફક્ત ટોકન ફી ભરેલ છે પરંતુ કોલેજ ખાતે રૂબરૂ હાજર થઈ પ્રવેશ કન્ફર્મ કરાવેલ નથી તેવા વિદ્યાર્થીઓ માટે)**

- જે વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે જઈ રૂબરૂ એડમિશન કન્ફર્મ કરાવેલ નથી માત્ર ટોકન ફી ભરેલી છે તેવા વિદ્યાર્થીઓ જે એડમિશન કેન્સલ કરાવવા માંગતા હોય તો તેમણે એડમિશન કેન્સલ કરાવવા માટે UGCANCEL@JAU.IN પર યોગ્ય કારણ સાથે ઇ-મેઇલ કરવાનો રહેશે. આ ઇ-મેઇલ સાથે તેમણે તમામ સાધનિક કાગળ (એડમિશન ફોર્મ, ટોકન ફી ભર્યાની રસીદ તેમજ જરૂરી તમામ સાધનિક આધારપુરાવા) સ્કેન કરી PDF/ JPEG ફોર્મેટમાં ઇ-મેઇલ સાથે બેડવાના રહેશે. ઇ-મેઇલમાં નીચે મુજબની માહિતી વિદ્યાર્થીએ પોતાના રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇડી પરથી UGCANCEL@JAU.IN પર મોકલવાની રહેશે.

**"નામ :**

**એપ્લીકેશન નંબર :**

**પ્રવેશ મળેલ કોલેજ :**

**ભરેલ ટોકન ફી રૂ. :**

**ચલણ નંબર અને તારીખ :**

**પ્રવેશ રદ કરાવવાનું કારણ :**

**ઉપરોક્ત કારણોસર હું મારૂં એડમિશન રદ કરાવવા માંગુ છું તો મારૂં એડમિશન નિયમોનુસાર કેન્સલ કરવા તથા નિયમોનુસાર મારી ઓનલાઇન ભરેલી ફી રીફંડ કરવા વિનંતી, ભવિષ્યમાં હું એડમિશન માટે કોઈ હક્ક કે દાવો કરી શકીશ નહીં જેની મને ખબર છે."**

- ત્યારબાદ ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઈ, જરૂરી ચકાસણી કરી તમારૂં એલોટેડ એડમિશન કેન્સલ કરવામાં આવશે તથા મેરીટમાંથી નામ દૂર કરવામાં આવશે.

- ત્યારબાદ તે વિદ્યાર્થીના રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇડી પર ટોકન ફીના રિફંડ માટેની લીંક મોકલવામાં આવશે. તેવા વિદ્યાર્થીઓ એ **રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇડી પર** મળેલ લીંક પર જરૂરી માહિતી ભરી સબમીટ કરી તેની એક પ્રીન્ટ કાઢી, તેમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટનો એક સેટ બનાવવાનો રહેશે. જે હાર્ડકોપીમાં **ફુલસચિવશ્રી ની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ-૩૬૨૦૦૧** ના સરનામે રજી.એડી./૩૭૩ અરજી પહોંચાડવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયે જે તે વિદ્યાર્થીની ટોકન ફી પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વધુમાં જે વિદ્યાર્થીઓની હાર્ડકોપી સમયમર્યાદામાં અત્રેની કચેરીને નહીં પહોંચે તે વિદ્યાર્થીની ટોકન ફી નિયમોનુસાર રીફંડ થઈ શકશે નહીં જેની વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ખાસ નોંધ લેવી.

### **Case No.-3 (કોઈપણ જગ્યાએ પ્રવેશ મળેલ નથી તેવા વિદ્યાર્થીઓ માટે)**

- જે વિદ્યાર્થીઓ ને કોઈપણ કોલેજ માં એડમિશન મળેલ નથી તેને એડમિશન કેન્સલ કરાવવાનું રહેતું નથી.

#### **ખાસ સુચના :**

- ✚ ઓનલાઇન ટોકન ફી પરત મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓને જણાવવાનું કે, ફી પરત મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ ફી પરત મેળવવા માટે લાયક હોવા ખેઈએ, તથા આવા લાયક ઉમેદવારોએ સ્નાતક કક્ષાના કોમન પ્રવેશ પ્રક્રિયાના અંતિમ રાઉન્ડ (તારીખ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે) ના એક દિવસ અગાઉ રિફંડ મેળવવાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે તથા હાર્ડકોપી ઉપરોક્ત સરનામે મોકલવાની રહેશે, **મુદત પુરી થયા બાદ અરજી કરનાર કોઈપણ વિદ્યાર્થીની ટોકન ફી નિયમોનુસાર રિફંડ કરવામાં આવશે નહીં** જેની તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ખાસ નોંધ લેવી.

#### **✚ હાર્ડ કોપી મોકલવાનું સરનામું :**

- ફુલસચિવશ્રી ની કચેરી,  
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,  
જૂનાગઢ-૩૬૨૦૦૧

#### **✚ ઓનલાઇન ભરેલી ફી પરત મેળવવા માટેનો ઇ-મેઇલ એડ્રેસ :**

- UGCANCEL@JAU.IN

#### **✚ માર્ગદર્શન માટે નીચેના ફોન નંબર પર સંપર્ક કરી શકાશે**

- ૦૨૮૫-૨૬૭૨૪૮૨